

# RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY



SHRI CHIMANIBHAI PATEL VIKAS BHAVAN, POST BOX NO. 238, JAMNAGAR ROAD, RAJKOT.

નં.- રૂડા/ટેક/ડી.બી./ઝોન સર્ટીફિકેટ/પુ.વિ.ચો./૨૦૩૧/૫૨૪૯

તા. ૦૩-૧૧-૨૦૧૮

પ્રતિ

શ્રી તુલશીભાઈ ખોડાભાઈ મેઘાણી તથા વિગેરે

c/o હિતેષ એમ અકબરી

"શ્રી પરમેશ્વર ઈન્ડ."

શ્રી હરિ ઈન્ડસ્ટ્રીઝ ઝોન, શેરી નં-૮,

મિરા ઊદ્યોગની બાજુમાં, રીંગ રોડ,

રાજકોટ.

વિષય :- ઝોનીંગ સર્ટીફિકેટ આપવા અંગે.

સત્તામંડળ (રૂડા)ની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ અન્વયે.

સંદર્ભ :- આપશ્રીની તા. ૦૧-૧૧-૨૦૧૮ ની અરજી અન્વયે.

ઉપરોક્ત વિષયે આપશ્રીની અરજીમાં જોદિષ્ટ વિસ્તાર/સાથે સામેલ નકશા મુજબ મોજે- વાવડી તાલુકો- રાજકોટ ના રેવન્યુ સર્વે નં.- ૭૦ અંતિમ ખંડ નં.- ૨૬ પ્લોટ નં.- ----- ની જમીન, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૭(૧)(સી) અન્વયેના સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા નં.- જીએચ/વી/૧૯૨ ઓફ ૨૦૧૬/ડીવીપી-૧૩૨૦૧૬-૨૨૩૭૦૨- એલ. તા. ૨૭-૧૦-૨૦૧૬ થી મંજૂર રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના- ૨૦૩૧ ની અમલી દરખાસ્તો મુજબ રહેણાંક ઝોન માં સુચિત કરાયેલ છે.

સદરહુ જમીન મોજે - વાવડી ની ટી.પી. સ્કીમ નં.- ૧૫ ના હદ વિસ્તારમાં આવતી હોવાથી, તેને ટી.પી. સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો/જોગવાઈઓ લાગુ પડશે અને ફેરફારને પાત્ર રહેશે.

ખાસ નોંધ:-

આ ફક્ત ઝોનીંગ સર્ટીફિકેટ છે. વિકાસ/બાંધકામની પરવાનગી નથી.

**TRUE COPY**  
**J. K. TALA**  
Advocate & Notary  
(GOVT. OF INDIA)  
Reg. No. 13149/2017


A.R. Patel  
જુનિયર નગર નિયોજક  
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ  
રાજકોટ



## PART PLAN OF

### SECOND REVISED DEVELOPMENT PLAN 2031 A.D.

(Sanctioned under sec 17 (1) (c) of the Gujarat Town Planning & Urban Development Act. 1976  
Vide U.D. & U.H. Department Notification No.GH/V/192 of 2016 /DVP-13-2016-223702-L, Dated 27-10-2016.  
Sanctioned Variation in the Second Revised Development Plan of RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY (RUDA)  
under Government Notification of Urban Development & Urban Housing Department  
No.GH/V/276 of 2017 /DVP-132017-725-L, Dated 13-10-2017 & it's Corrigendum No.GH/V/296 of 2017 /DVP-132017-725-L, Dated 24-10-2017.



In case of Any Errors/Disputes The Record At Ruda Office Shall Be Considered Official & Shall Be Final & Binding to All.  
NOTE : This Part Plan can not be used for making any entry in revenue records and can not be Considered as Development Permission for Addition/Alteration.

#### ISSUED ONLY FOR

SURVEY NO.: 70  
VILLAGE : VAVDI  
TALUKA : RAJKOT  
T.P.S. NO. : 15  
F.P. NO. : \_\_\_\_\_  
Prepared By : [Signature]  
Checked By : [Signature]  
DATE : 2-NOV-2018


TRUE COPY

J. K. TALA

Advocate & Notary

(GOVT. OF INDIA)

Reg. No. 13149/2017



SCALE 1CM. = 80 MT.

#### LEGEND

- Residential Zone
- Water Body
- Existing Road
- Proposed Road
- Gamtal
- Reservation
- TPS Boundary
- Village Boundary

TRUE COPY

A.R. Patel  
JUNIOR TOWN PLANNER  
RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY  
RAJKOT